



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૧/૦૪/૨૦૧૯ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૮૨/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૧૨૧ કેસ કરી, ૧૦૭ વ્યક્તિઓને ઝડપી, ૪૭૭ લીટર દેશી દારૂ, ૮૧ બોટલ ઇંગ્લીશ દારૂ, ૧૮૨૮ ક્વોટર ઇંગ્લીશ દારૂ, ૦૧ કાર, ૦૧ રીક્ષા અને ૦૧ મોટર સાયકલ કબજે કર્યું હતું. તેમજ જુગારધારા હેઠળ ૦૮ કેસ કરી ૩૬ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૪૧,૦૯૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૮૩/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૮,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૨૪૦ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૮૭ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૫૮૪/૧૯

સાયબર ક્રાઈમ : ડૉ.શાલીની રાજકુમાર પાંડીયન(ઉ.વ.૪૪)(રહે.શરણમ-૧૦, પ્રહલાદનગર) એ તા.૩૧/૦૩/૧૯ ના રોજ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૭/૦૩/૨૦૧૯ બપોરના ૩/૦૦ થી તા.૨૮/૦૩/૨૦૧૯ સાંજના ૭/૦૦ વાગ્યા દરમિયાન આરોપી (૧) મોબાઇલ નંબર ૭૪૩૬૯૭૮૮૨૩ થી રાહુલ સક્શેના નામથી વાત કરનાર (૨) ૭૪૩૬૯૭૮૮૨૬ પરથી વાત કરનાર રોહન નામ ની વ્યક્તિ તથા (૩)નવીનકુમાર નામની વ્યક્તિ એ ભેગામળી ડૉ.શાલીની ને “Lakme Salon” ની ખરાબ સર્વિસ પેટે વળતર આપવાનું જણાવી, ડૉ.શાલીની ના ICICI બેંકના ખાતાની વિગતો મેળવી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી, ડૉ.શાલીની પાસેથી OTP નંબર મેળવી, તેઓની સંમતી વગર તેમના બેંક એકાઉન્ટમાંથી કુલ રૂપિયા ૧,૩૭,૦૨૩/- મેળવી લઈ, વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી વી.બી બારડ ચલાવે છે.

સોનાની ચેઇન ખેંચી તોડી લઈ ગયા :-

સમાચાર યાદી નં.૫૮૫/૧૯

વાસણા : રાજેન્દ્રભાઈ ઈન્દ્રવદન મણીયાર (ઉ.વ.૫૨)(રહે.અગ્નિહોત્રી ખડકી ઢોળ તા: જાંબુશર જી: ભરૂચ) તા.૩૧/૦૩/૨૦૧૯ ના કલાક ૦૭/૩૦ વાગ્યાના સુમારે તીર્થ બંગ્લોઝ હિરેનભાઈ દોષીના દવાખાના ની સામે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા દરમિયાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ રાજેન્દ્રભાઈના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- મતાની ખેંચી તોડી લઈ નાસી ગયા છે. આ અંગેની ફરીયાદ રાજેન્દ્રભાઈ મણીયાર એ વાસણા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એસ.બી.ચૌધરી ચલાવે છે.

દરીયાપુર : અશોકકુમાર નવલમલ શાહ (ઉ.વ.૬૨)(રહે.બાલાજી રેસીડન્સી રામબાગ રોડ સાબરમતી)
તા.૩૧/૦૩/૨૦૧૯ ના કલાક ૦૭/૧૫ વાગ્યાના સુમારે દરિયાપુર ક્રીકા ભટ્ટની પોળ નજીક રોડ ઉપરથી
પસાર થઈ રહ્યા હતા દરમ્યાન મોટર સાયકલ ઉપર આવેલ એક પુરૂષ (૩૦થી ૩૫ વર્ષના આશરાનો)
અશોકકુમાર ના ગળામાંથી સોનાની પેડલ સહિતની ચેઈન કિંમત રૂપિયા ૭૫,૦૦૦/- મતાની ખેંચી તોડી
લઈ નાસી ગયો છે. આ અંગેની ફરીયાદ અશોકકુમાર શાહ એ દરીયાપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે.
આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એસ.એ.પાટીલ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.